

ત્વરિત જાહેરાત માટે

વિલિયમ્સ પાર્કવે ઓપરેસન્સ સેન્ટર (Williams Parkway Operations Centre)ને મળે છે લીડ@ગોલ્ડ સર્ટિફિકેશન (LEED® Gold Certification)

બ્રેમ્પટન, ઓન્ટારિયો (06 મે 2019) – ફરી એક વખત સીટી ઓફ બ્રેમ્પટનને તેના પર્યાવરણીય રીતે ટકાઉ મકાનો માટે સન્માનિત કરવામાં આવ્યું છે. કેનેડા ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (Canada Green Building Council) પાસેથી વિલિયમ્સ પાર્કવે ઓપરેસન્સ સેન્ટર (The Williams Parkway Operations Centre)(WPOC) દ્વારા લીડરશિપ ઇન એનર્જી એન્ડ ઇન્વાયરમેન્ટલ ડિઝાઇન (Leadership in Energy and Environmental Design) (લીડ (LEED)®) ગોલ્ડ સર્ટિફિકેશન (Gold certification) હાંસલ કરવામાં આવ્યું છે.

WPOC બે માળનું 3,700 ચોરસ-મીટર ક્ષેત્રફળ ધરાવતું બગીચો, અને ઈવેન્ટ ટેરેસ, હરિયાળી જગ્યાઓ, અને કર્મચારી તેમજ સાર્વજનિક પાર્કિંગ સાથેનું વહીવટી ભવન છે. તેને લીડ (LEED) સર્ટિફિકેશન મેળવવા માટે જવાબદાર કેટલાક પર્યાવરણીય મુદ્દાઓ નીચે મુજબ છે:

- ઓન સાઈટ જલ વપરાશમાં ઘટાડો (દા.ત. લો ફ્લો ફિક્સચરનો ઉપયોગ કરીને, કોઈ લેન્ડસ્કેપ સિંચાઈ પ્રણાલી વિના)
- સ્ટોર્મ વોટર સિસ્ટમમાં રનઓફ ઘટાડવા માટે સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ તળાવ બાંધવામાં આવ્યું
- હીટ આઈલેન્ડ ઈફેક્ટ ઘટાડવા માટે એવી રૂફિંગ સામગ્રીનો ઉપયોગ થયો જે સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે
- બિલ્ડિંગ ઓટોમેશન સાથે જિઓથર્મલ હીટ પમ્પ સિસ્ટમ
- ટ્રિવ-ચક્રી સાયકલના સ્ટેન્ડ અને ત્રણ ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો આપીને વૈકલ્પિક પરિવહન માટે સહાયતા
- શાકભાજીની વાળી સાથેની હરિયાળી છત જે હીટ આઈલેન્ડ ઈફેક્ટ અને શીત કરવાનું ભારણ એટલે કે કૂલિંગ લોડ ઘટાડે
- સાહજિક લેન્ડસ્કેપિંગ જે સિંચાઈની જરૂરિયાત દૂર કરે અને જેને પરિણામે જળનો વપરાશ ઘટાડે

લીડ (LEED)® સર્ટિફિકેશન મકાનના રચનાત્મક, બાંધકામલક્ષી અને પ્રચાલનના ઉત્કૃષ્ટ પર્યાવરણીય ટકાઉપણાંને સન્માનિત કરે છે. લીડ (LEED)® સર્ટિફિકેશન મેળવવા માટે પરિયોજનાઓએ એક કરતા વધુ વર્ગોમાં પોઈન્ટ કમાવવા પડે છે, જેમ કે, ઠેકાણું અને પરિવહન, જળ કાર્યક્ષમતા, ઊર્જા અને વાતાવરણ, સામગ્રી અને સંસાધનો, નવકલ્પનાઓ અને બીજું ઘણુંબધું. કેટલા પોઈન્ટ કમાયા તેની સંખ્યાને આધારે પ્રોજેક્ટ પછી ચાર પૈકી એક લીડ (LEED)® રેટિંગ સ્તર પ્રાપ્ત કરે છે: સર્ટિફાઈડ સિલ્વર, ગોલ્ડ અથવા પ્લેટિનમ. WPOC પ્રોજેક્ટ જે 2015માં પૂર્ણ થયો તેને 60 પોઈન્ટ મળ્યાં હતાં જેથી ગોલ્ડ રેટિંગ માટે લાયક ગણાયું.

સીટી ઓફ બ્રેમ્પટન લીડ (LEED)® સર્ટિફિકેશન મેળવવા 2007ની સાલથી કોશિશ કરતું આવ્યું છે. નીચે આપેલ પ્રોજેક્ટ દ્વારા પણ લીડ (LEED)® ગોલ્ડ સર્ટિફિકેશન હાંસલ કરવામાં આવ્યું છે:

- બ્રેમ્પટન ફાયર સ્ટેશન 212

- સીટી હોલ ઉમેરો અને વેસ્ટ ટાવર
- બ્રમ્પ્ટન ફાયર સ્ટેશન 211 અને પીલ પેરામેડિક સેન્ટર
- ગોર મેડોઝ કમ્યુનિટી સેન્ટર (Gore Meadows Community Centre) અને લાયબ્રેરી

નીચે આપેલ પ્રોજેક્ટની રચના અને બાંધકામ લીડ(LEED)® માનકો અનુસાર થયા છે અને અંતિમ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાની તૈયારીમાં છે:

- સિંગ્રંગડેલ લાયબ્રેરી (Springdale Library)
- WPOC તબક્કો 2
- બ્રમ્પ્ટન એપેરેટસ એન્ડ મેન્ટેનન્સ બિલ્ડિંગ (Brampton Apparatus & Maintenance Building)
- બ્રમ્પ્ટન ફાયર સ્ટેશન 204 ઉમેરો

ક્વોટ

"આ સત્રમાં કાઉન્સિલના દિશાસૂચનો પૈકી એક એટલે ગ્રીન સીટી બનાવવું. એમિશનો ઘટાડવા માટે અને બ્રમ્પ્ટનને વધુ ટકાઉ શહેર બનાવવા માટે અમે નીચે આપેલ અન્ય ટકાઉ લીડ (LEED)® સિદ્ધાંતોને વળગી રહેવા પ્રતિબદ્ધ છીએ."

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પ્ટનમાં 650,000 લોકો વસે છે અને ત્યાં 70,000 વ્યાપારો છે. અમે જે કરી કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પ્ટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca